

૭૪માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા ૭૪માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તા.૧૫/૦૮/૨૦૨૦ ના રોજ સવારે ૮.૩૦ કલાકે યુનિવર્સિટી ભવન ખાતે માન. કુલપતિશ્રી ડૉ. આર.વી. વ્યાસના વરદ હસ્તે ધ્વજ ફરકાવી કરવામાં આવેલ. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પ્રવર્તમાન નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) ના સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરીને યુનિવર્સિટીના સર્વે અધિકારીશ્રીઓ, ડીનશ્રીઓ, મર્યાદિત હાજરીમાં કર્મચારીઓ, વસાહતી ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે માન. કુલપતિશ્રી ડૉ. આર.વી. વ્યાસ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં દેશની આઝાદી દરમ્યાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરેલ, નમન કરેલ અને માં ભોમની રક્ષા કાજે તાજેતરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પિત કરેલ. આત્મનિર્ભર કૃષિ, નવી શિક્ષણ નિતી, નવા FPO ખોલવા વગેરે પર વિશેષ ભાર મુકેલ. હાલનાં સમયમાં કોરોના મહામારીમાં પોતાના જીવના જોખમે કાર્ય કરી રહેલ કોવીડ વોરીયરની સેવાઓને પણ બીરદાવેલ. ઉપરાંત, આણંદ કૃષિ યુનિવર્સિટી કે જે સરદાર સાહેબના સ્વપ્ન થકી સાકાર થયેલ છે. તેણે કોરોનાના કપરા કાળમાં કાર્યરત રહી તે બદલ તમામ અધિકારીઓ, કર્મચારીઓ, ખેતમજૂરોને બીરદાવી આભાર પ્રગટ કરેલ. યુનિવર્સિટીના સર્વે અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે જે ઝડપથી આગળ વધી રહી છે તેમાં હજુ ઉત્તરોત્તર વધારો કરે તેવું આહવાન આપેલ. કેપ્ટન પી.એ ગોહિલ દ્વારા પરેડ કમાન્ડન્ટ તરીકેની ફરજ બજાવેલ. કાર્યક્રમના ઉદઘોષક તરીકેની કામગીરી ડૉ. જે.બી. નાયક દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ ડૉ. દિનેશ એચ. પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.

